

Positive Pay System for CTS(PPS)

આથી સર્વે ખાતેદારો ને જણાવવાનું કે RBI મારફતે નવી ક્લીયરિંગ સિસ્ટમ ચાલુ કરવામાં આવેલ છે.

જેનું PPS (POSITIVE PAY SYSTEM) નામ આપવામાં આવેલ છે. અને તે ૦૧/૦૧/૨૦૨૧ ના રોજ થી લાગુ પડશે, જેના નિયમો નીચે મુજબ છે.

- જો તમે ૫,૦૦,૦૦૦/- કે તેથી વધુની રકમનો ચેક ઇસ્યુ કરવા માંગતા હોય તો પહેલા તમારે બેંકમાં તેની જાણ કરવી પડશે.
- જાણ કર્યા સિવાયના આવા કોઈ પણ ચેક બેંક પાસ નહીં કરે તેની નોંધ લેશો.
- બેંક ને જાણ કરવાની પદ્ધતિ બેંક ધ્વારા તમને જણાવવામાં આવશે.
- ચેક પાર્ટી ને આપતા પહેલા ચેકને બેંક સમક્ષ રજૂ કરી PPS (POSITIVE PAY SYSTEM) માં એન્ટ્રી કરાયા બાદ તમે તેને પાર્ટી ને ઇસ્યુ કરી શકો છો. જો આમ નહીં કરવામાં આવે તો તમારો ઇસ્યુ કરેલ ચેક બેલેન્સ હોવા છતાં રિટર્ન થશે તેની નોંધ લેશો.
- RBI ધ્વારા નક્કી કરેલ લિમિટ ૫૦,૦૦૦/- થી ૪,૯૯,૯૯૯/- સુધી મરજિયાત રાખેલ છે અને ૫,૦૦,૦૦૦/- કે તેથી વધુ રકમ માટે ફરજિયાત પણે PPS (POSITIVE PAY SYSTEM) નો અમલ કરવો ફરજિયાત છે. તેનો અમલ નહીં કરવામાં આવે તો ચેક રિટર્ન બેંક કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી ખાતેદારની રહેશે.
- PPS (POSITIVE PAY SYSTEM) ની વધુ માહિતી માટે બેંકનો સંપર્ક કરવો.

સહ, સહકાર અપેક્ષા,



भारतीय रिज़र्व बैंक
RESERVE BANK OF INDIA
www.rbi.org.in

RBI/2020-21/41

DPSS.CO.RPPD.No.309/04.07.005/2020-21

September 25, 2020

The Chairman and Managing Director / Chief Executive Officer
All Scheduled Commercial Banks including Regional Rural Banks /
Urban Co-operative Banks / State Co-operative Banks /
District Central Co-operative Banks / Local Area Banks / Payment Banks /
Small Finance Banks / National Payments Corporation of India

Madam / Dear Sir,

Positive Pay System for Cheque Truncation System

Please refer to the [Statement on Developmental and Regulatory Policies dated August 6, 2020](#) wherein Reserve Bank of India (RBI) had announced introduction of Positive Pay System for Cheque Truncation System (CTS).

2. The concept of Positive Pay involves a process of reconfirming key details of large value cheques. Under this process, the issuer of the cheque submits electronically, through channels like SMS, mobile app, internet banking, ATM, etc., certain minimum details of that cheque (like date, name of the beneficiary / payee, amount, etc.) to the drawee bank, details of which are cross checked with the presented cheque by CTS. Any discrepancy is flagged by CTS to the drawee bank and presenting bank, who would take redressal measures.

3. National Payments Corporation of India (NPCI) shall develop the facility of Positive Pay in CTS and make it available to participant banks. Banks, in turn, shall enable it for all account holders issuing cheques for amounts of ₹50,000 and above. While availing of this facility is at the discretion of the account holder, banks may consider making it mandatory in case of cheques for amounts of ₹5,00,000 and above.

4. Only those cheques which are compliant with above instructions will be accepted under dispute resolution mechanism at the CTS grids. Member banks may implement similar arrangements for cheques cleared / collected outside CTS as well.

5. Banks are advised to create adequate awareness among their customers on features of Positive Pay System through SMS alerts, display in branches, ATMs as well as through their web-site and internet banking.
6. Positive Pay System shall be implemented from January 01, 2021.
7. This directive is issued under Section 10 (2) read with Section 18 of Payment and Settlement Systems Act, 2007 (Act 51 of 2007).

Yours

faithfully (P

Vasudevan)

Chief General Manager